

ત્વરિત જાહેરાત માટે

2019 બ્રેમ્પટન મુલાકાતી માર્ગદર્શિકાથી બ્રેમ્પટન વિશે વધુ જાણો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 30, 2019) – અદ્યતન કુદરતી સ્થળો અને પગદંડીઓથી માંડીને, મહાન પૌરાણિક સાંસ્કૃતિક આયોજનો અને રાંધણકળાને લગતા અનુભવો સુધી, બ્રેમ્પટન પાસે તમામ ઉંમરના રહેવાસીઓ અને મુલાકાતીઓને આપવાલાયક પુષ્કળ છે.

માહિતગાર રહેવામાં મદદ મેળવવા, 2019 બ્રેમ્પટન મુલાકાતી માર્ગદર્શિકા હવે ઓનલાઇન સોફ્ટ કોપીમાં અને છાપેલી હાર્ડ કોપીમાં ઉપલબ્ધ છે. રહેવાસીઓ અને મુલાકાતીઓ છાપેલી નકલ બ્રેમ્પટન સીટી હોલમાંથી મેળવી શકે છે, અથવા ઇલેક્ટ્રોનિક આવૃત્તિ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે www.brampton.ca/tourism.

વાર્ષિક માર્ગદર્શિકામાં બ્રેમ્પટનના લોકો, સ્થળો, આયોજનો અને વારસો જેવી ઝાંખી જોવા મળે છે, અને વાચકોને આપણાં વૈવિધ્યસભર શહેરમાં નવા અનુભવો કરવાનું નિમંત્રણ આપે છે.

ઝાંખીઓ

- આ વર્ષની માર્ગદર્શિકામાં દર્શાવેલી પચાસ ટકા છબીઓને સોશિયલ મીડિયા પર રહેવાસીઓ અને મુલાકાતીઓએ લીધી હતી.
- આ વર્ષની માર્ગદર્શિકામાં સંખ્યાબંધ યશસ્વી બ્રેમ્પટનવાસીઓનો ઉલ્લેખ છે, જેમાં સામેલ છે:
 - જાણીતા કવિ અને બ્રેમ્પટન આર્ટ્સ વોક ઓફ ફેમમાં સ્થાન મેળવનાર [રુપિ કૌર \(Rupi Kaur\)](#).
 - પ્રભાવક, પ્રેરણાદાયી વક્તા, સાહસિક ધંધાદારી અને બ્રેમ્પટનના પોતાના [ટી બાય ડેનીયલ \(T by Daniel\)](#), ડેનીયલ લુઈસના સ્થાપક.
 - ગીતકાર અને સંગીતકાર રાઝ ([Raz](#)).
- બ્રેમ્પટનમાં દુનિયાભરની વાનગીઓનો પ્રવાસ, અને કંઈક “ઓન્લી ઈન બ્રેમ્પટન” બાઈટ્સ (બટકું).
- શહેર છોડ્યા વગર બહારની દુનિયા જેવો આનંદ અપાવતા ઉદ્યાનો, પગદંડીઓ અને સગવડો.
- થિયેટરો, ગેલેરીઓ અને ઐતિહાસિક સ્થળોથી કળા, સંસ્કૃતિ અને વારસો જેવી ઝાંખીઓ.
- વર્ષભર ચાલતી પ્રવૃત્તિઓ અને સમગ્ર શહેર જોવાલાયક સ્થળો.

2019 ની બ્રેમ્પટન મુલાકાતી માર્ગદર્શિકા ટુરિઝમ ટોરોન્ટો, ઓન્ટેરિયોની પ્રાદેશિક ટુરિઝમ સંસ્થા #5, અને સીટી ઓફ બ્રેમ્પટન સાથેના સહયોગમાં બનાવવામાં આવી છે. આ માર્ગદર્શિકાની નકલો સમગ્ર ઓન્ટેરિયોમાં ટુરિઝમ ઇન્ફર્મેશન સેન્ટર્સ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, હોટેલ્સ, ઇન્ડસ્ટ્રી ટુર ઓપરેટર્સ અને ઘણાંને વિતરિત કરવામાં આવી છે.

અવતરણ (ક્વૉટ):

“રહેવાસીઓ અને મુલાકાતીઓને બ્રેમ્પટન એકસરખી શ્રેણીના વિશ્વસ્તરીય અજોડ અનુભવો આપે છે. બ્રેમ્પટનમાં અસાધારણ રાંધણકળા અને રોમાંચક અને તહેવારો, સંગીત અને નાટ્યકળા સહિતના ઊભરતા સાંસ્કૃતિક દૃશ્યોથી માંડીને, પગદંડીઓ અને ઉદ્યાનોનું વ્યાપક નેટવર્ક જેવું બધું છે. હું દરેક વ્યક્તિને મુલાકાતી માર્ગદર્શિકાની નકલ મેળવવા અથવા તે ઓનલાઇન જોવા પ્રોત્સાહિત કરું છું. તે આપણાં શહેરને જાણવાની શ્રેષ્ઠ રીતો પૈકી એક છે.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

सीटी ओइ ब्रैम्पटन विशे विषे वधु माडिती माटे अर्डी मुवाकान वो www.brampton.ca अने [Twitter](https://twitter.com) पर, [Facebook](https://facebook.com) पर, अने [Instagram](https://instagram.com) पर अमने डोवो करो.

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूहान्मक संवाट

सीटी ओइ ब्रैम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca